

WCL/SEC/2024

September 06, 2024

To,

BSE Ltd.	National Stock Exchange of India Ltd.
Listing Department,	Exchange Plaza,
P. J. Towers, Dalal Street,	Bandra-Kurla Complex,
Mumbai – 400 001.	Bandra (E), Mumbai – 400 051.
(Scrip Code: Equity - 532144),	(Symbol: WELCORP, Series EQ)
(NCD - 960491 and 973309)	
The Calcuatta Stock Exchange Limited.	
7, Lyons Range, Kolkatta – 700 001.	
(Scrip Code - 33124/10033124)	

Dear Sir/ Madam,

Subject: Newspaper Advertisement

Pursuant to the applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose the copies of newspaper advertisements published in Financial Express (English), Kutchmitra and Kutchuday (Gujarati), in compliance with the relevant circulars issued by the Ministry of Corporate Affairs, from time to time, with respect to holding of 29th Annual General Meeting of the Company to be held on Thursday, September 26, 2024 at 3.30 p.m. through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") and completion of dispatch of Annual Report and Notice to the shareholders including details regarding e-voting facility as per Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Please take the above information on record.

Thanking You.

Yours Faithfully, For **Welspun Corp Limited**

Paras Shah Assistant Company Secretary ACS - 30357

E-mail: companysecretary_wcl@welspun.com Website: www.welspuncorp.com

Registered Address: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat 370 110, India. T: +91 2836 662222 F: +91 2836 279060

FINANCIAL EXPRESS

AMTL

ADVANCE METERING TECHNOLOGY LIMITED Corporate Identity Number (CIN): L31401DL2011PLC271394

Registered Office: E-8/1, Near Geeta Bhawan Mandir, Malviya Nagar, New Delhi-110017 Corporate Office: C-4 to C-11, Hosiery Complex, Phase-II Extension, Noida-201305 (U.P.) Tel. No: 0120-6958777 Website: https://www.pkrgroup.in Email: corporate@pkrgroup.in IOTICE OF THE 13TH ANNUAL GENERAL MEETING (AGM) - REMOTE E-VOTING INFORMATION

furtherance to Notice published on September 04, 2024 for the 13th AGM of the Compan scheduled to be held on Thursday, September 26, 2024 at 10.30 A.M. through video conference other audio visual means (OAVM), this is to inform that in compliance with General circular 09/2023 dated September 25, 2023 issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circular No SEBI/HO/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 7, 2023 issued by Securities and Exchange Board of India ("SEBI") and other related circulars issued by MCA and SEBI from time to time collectively referred as 'circulars'), the Notice of the 13th AGM along with the Annual Report of the Company, have been sent through e-mail to all the members whose email addresses are registered with the Company/Depository Participants (DPs) as on August 26, 2024. These documents are also available on Company's website (www.pkrgroup.in), website of the Stock Exchanges i.e. BSE Limited (www.bseindia.com) and on the website of Central Depository Services (India) Limited "CDSL") i.e. www.evotingindia.com. The electronic dispatch of Annual Report through emails has been completed on Wednesday, September 04, 2024. The procedure to join the meeting through COAVM and E-voting process is provided in the Notice of AGM. The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, the 20th September, 2024 to Thursday, the 26th September, 2024 (both days inclusive) for the purposes of 13th AGM The Company through CDSL will be providing facility of remote e-voting and e-voting at the AGM

to its Members in respect of the businesses to be transacted at the AGM and also the facility to

The remote e-voting period shall commence on Monday, 23rd September, 2024 at 9:00 a.m. and ends on Wednesday, 25th September, 2024 at 5:00 p.m. The remote e-voting shall not allowed beyond the said date and time. CDSL will disable the remote evoting module after that. The cutoff date for determining entitlements of electronic voting on Thursday September 19, 2024. The members who have cast their vote through remote e-voting prior to the meeting may also attenthe meeting but shall not be entitled to cast their vote again. Any person, who acquires shares of the company and become member of the company after

dispatch of the notice and holding shares as on cut-off date i.e. September 19, 2024 may obtain login ID and password by sending an email to helpdesk.evoting@cdslindia.com by mentioning the folio No./DP ID and client ID for casting their vote and attend AGM. n case of any queries/grievances, Members may refer to the "Frequently Asked Questions (FAQs

for Members and participation in AGM and remote e-Voting user manual for Members' available at downloads section of http://www.evotingindia.com or call at 1800 21 09911 or send a request to Mr. Rakesh Dalvi, Sr. Manager, CDSL, at helpdesk evoting@cdslindia.com

> For Advance Metering Technology Limited Rakesh Kumar

Place: New Delhi Dated: 05th September, 2024

Company Secretary & Compliance Officer M.No. FCS 12868

JULIEN AGRO INFRATECH LIMITED **FORMERLY: SILVERPOINT INFRATECH LIMITED** CIN: L28219WB1997PLC083457 Regd. Office: "85, Bentick Street, 5th Floor, Yashoda Chamber,

Room No. 6, Lalbazar, Kolkata- 700 001 Phone: 82320 62881, E-mail: info@julieninfra.com Website: www.julieninfra.com NOTICE

NOTICE is hereby given that the 27th Annual General Meeting (AGM) of the

Members of M/s. Julien Agro Infratech Limited formerly known as Silverpoint Infratech Limited will be held on Monday, the 30th day of September, 2024 at 09:30 A.M. at "Diamond Plaza, 5 Gopi Ghosh Lane, Kolkata- 700 012" to transact the Ordinary and Special Business as set out in the Notice dated September 04, 2024. Notice convening the AGM setting out the business to be transacted at the Meeting along with the Explanatory Statement, Financial Statement, Attendance Slip, Proxy Form and the Circular for Voting through electronic means will be sent to the Members. The Company has also uploaded these documents on the website of the Company at www.julieninfra.com. Further, Notice is hereby given that pursuant to Section 91 of the Companies Act,

2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules 2014 and Regulation 42 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24th September, 2024 to 30th September, 2024 (both days inclusive) for the purpose of the AGM of the Company. Members are advised that the business at the AGM may be transacted through E-

voting. The E-voting period commences on 27th September, 2024 at 9.00 A.M and ends on 29th September, 2024 at 5.00 P.M. The E-voting shall not be allowed beyond the said date and time. During this period the members of the Company holding shares either in physical form or in dematerialized form as on the cut-off date record date) i.e September 23, 2024 may cast their vote electronically. The shareholders attending the meeting physically or through proxy may cast their

vote through ballot at the venue of the meeting. However, in case of vote already casted through remote e-voting, any further voting at venue through ballot shall be treated as invalid and voting through remote e-voting shall prevail. Mrs. Pooja Bansal, Practicing Company Secretary, Kolkata has been appointed as

the Scrutinizer for the e-voting and voting by ballot process in a fair and transparent For any grievance in the matter of e-voting, the undersigned may be contacted by e-

mail at info@julieninfra.com or over phone at 91.82320 62881 By Order of the Board

For Julien Agro Infratech Limited (Formerly: Silverpoint Infratech Limited) Puja Jain

Place: Kolkata Date: September 04, 2024

MAAN

MAAN ALUMINIUM LIMITED

Regd. Off: 4/5, 1st Floor, Asaf Ali Road, New Delhi-110002

CIN: L30007DL2003PLC214485, Ph: 40081800.

Email: info@maanaluminium.in / Website: www.maanaluminium.com

NOTICE OF 21st ANNUAL GENERAL MEETING AND INFORMA-

TION REGARDING ELECTRONIC VOTING

Notice is hereby given that the 21th Annual General Meeting ('AGM'

of the Members of the Maan Aluminium Limited ('Company') is scheduled

to be held on Thursday, 26th September, 2024 at 01:00 P.M. (IST)

through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM"

to transact the businesses as set out in the Notice of AGM, in compliance

with the all applicable provisions of the Companies Act, 2013 (the 'Act')

rules made thereunder, Securities and Exchange Board of India (Listin

Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing

Regulations') read with General Circular number 14/2020, 17/2020, 20.

2020, 2/2022, 10/2022, 09/2023 and all relevant circulars issued by the

Ministry of Corporate Affairs (collectively referred to as 'MCA Circulars') and

Circular no. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020

Circular No. SEBI/HO/CFD/CMD/ CIR/P/2020/242 dated December 9

2020, Circular no: SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January

2021, Circular no. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 May 13, 2022

SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 and other

relevant circulars issued by the Securities and Exchange Board of India

(hereinafter collectively referred to as 'SEBI Circulars'), which permitted to

hold AGM through VC/ OAVM, without the physical presence of the

Members at the common venue. A detailed instruction for joining the AGM

In compliance with the provisions of the Act, SEBI Listing Regulations

MCA Circulars & SEBI Circulars, the Notice of 21th AGM and Annual

Report of the Company for the financial year 2023-24 have been sent

on 04th September, 2024, through electronic mode, to those Members

of the Company whose email IDs are registered with the Company/its

Registrar and Share Transfer Agent or Depository Participant(s)

("Depository"). The aforesaid Notice of 21th AGM and Annual Report for

the financial year 2023-24 are also available and can be downloaded

from Company's website at www.maanaluminium.com and also can be

downloaded from the website, on the website of the Stock Exchange i.e.

BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India

Limited at www.nseindia.com and on the website of Link Intime India Pvt.

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20

of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of SEBI Listing Regulations, the Company

is providing remote e-voting facility prior to AGM and facility of e-voting

system during the AGM to all the eligible Members of the Company to cast

their votes on a resolutions set forth in the Notice of the AGM using

remote e-voting and e-voting system (collectively referred as "electronic

voting"). The Company has engaged the services of Link Intime India Pvt.

Ltd (Link Intime) as the agency to provide the electronic voting facility.

The Board of Directors of the Company has appointed M/s. AAbhinav &

Associates, Practicing Company Secretary, as the Scrutinizer to scrutinize

the voting process electronically or otherwise for remote e-Voting and

e-Voting at the AGM in a fair and transparent manner. The results of the

electronic votingon the resolutions set out in the Notice of the AGM along

with Scrutinizer's Report will be declared within the permissible time under

applicable law. The results and Scrutinizer's Report will also be displayed

on the website of the Company i.e. www.maanaluminium.com, website

of Stock Exchange i.e., BSE Limited at www.bseindia.com and National

Stock Exchange of India Limited at www.nseindia.com and on the website

The remote e-voting shall commence on 23rd September, 2024 (9:00

A.M.) and will end on 25th September, 2024 (5:00 P.M.). Remote e-voting

A person whose name appears in the Register of Members/Beneficial

owners as on the cut-off date i.e. 19th September, 2024, shall be entitled

to avail the facility of electronic voting. The voting rights of the Members

shall be in proportion to their share of the paid-up equity share capital of

the Company as on the cut-off date i.e. 19th September, 2024. Any

person who has acquired shares and become members of the Company

after dispatch of Notice of AGM and holds share(s) as on the cut-off date.

can also cast vote through electronic voting. The detailed procedure for

obtaining login details is provided in the Notice of the AGM which is

Those Members who are present at the AGM through VC/OAVM facility

and have not casted their votes on the resolutions via remote e-voting

shall be eligible to vote through e-voting during the AGM. The members

who have cast their vote by remote e-voting prior to the meeting may also

attend the AGM through VC/OAVM but shall not be allowed to cast their

vote again at the AGM. A person who isnot a member as on the Cut-off

Members who have not registered their email ID may get the same

registered/updated with Company / RTA or Depository to cast their vote

(s) through remote e-voting before the AGM or through e-voting during

the AGM. The manner of the registering email addresses of those Members whose email addresses are not registered with Company/Depository is

provided in the Notice of the AGM which is available on Company's website

In case the shareholders have any queries or issues regarding e-voting,

you may refer the Frequently Asked Questions ("FAQs") and Instavote e-

Voting manual available at https://instavote.linkintime.co.in. under Help section

or write an email to enotices@linkintime.co.in or Call us:-Tel: 022-49186000

Place: New Delhi

Date: 05.09.2024

By order of the Board

Ravinder Nath Jain

For Maan Aluminium Limited

available on Company's website www.maanaluminium.com.

date should treat this Notice for information purposes only.

of Link Intime India Pvt. Ltd. i.e. https://instavote.linkintime.co.in.

shall not be allowed beyond the said date and time.

The details as required pursuant to the Act and Rules are a under:

through VC/OAVM is given in the Notice of the AGM.

Ltd. i.e. https://instayote.linkintime.co.in.

(Company Secretary) Memb No. 38570



TATA POWER

(Corporate Contracts Department) The Tata Power Company Limited, 2rd Floor, Sahar Receiving Station Sahar Airport Road, Andheri East, Mumbai-400059 (Board Line: 022-67173917) CIN: L28920MH1919PLC000567

NOTICE INVITING TENDER (NIT)

The Tata Power Company Limited invites tender from eligible vendors for the following tender packages (Two-part Bidding) in Mumbai Distribution:

- OLA for Supply of 11 kV RMU (Ref: CC25VJS022)
- OLA for Supply of LT Power Cables (Ref: CC25VJS023) OLA for Supply of Package Substations (PSS) (Ref: CC25VJS024)
- OLA for Supply of 33 kV RMU (Ref: CC25VJS025) OLA for Supply of 11 kV RMU with CTPT Units (Ref: CC25VJS026)
- OLA for Yard Management services (Ref: CC25VJS027)
- OLA for Cable Trenching, Laying and Jointing services (Ref: CC25VJS028) Interested bidders to submit Tender Fee and Authorization Letter up to Monday, 16" Sep 2024.

For detailed NIT, please visit Tender section on website https://www.tatapower.com Also, all future corrigendum's (if any), to the above tenders will be informed in Tender

section on website https://www.tatapower.com only

Welspun corp

WELSPUN CORP LIMITED (Corporate Identification Number - L27100GJ1995PLC025609)

Regd. Office: Welspun City, Village Versamedi, Taluka Anjar, Dist. Kutch, Gujarat - 370110. Tel No. +91 2836 662222 Fax: +91 2836 279060.

Corp. Office: Welspun House, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel. Mumbai-400013. Tel No. 022 - 2490 8000. Fax: 022 - 2490 8020 CompanySecretary_WCL@welspun.com www.welspuncorp.com

NOTICE of 29th Annual General Meeting of Welspun Corp Limited

NOTICE is hereby given that the 29th Annual General Meeting ("AGM") of the members of the Company will be held on **Thursday, September 26, 2024 at 3:30 p.m.** through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice of the AGM only through e-voting facility. The AGM will be held only through VC / OAVM in compliance with the provisions of the

Companies Act, 2013 and circulars issued by the Ministry of Corporate Affairs and the SEBI, from time to time. The facility for appointment of proxy will not be available for the AGM. The instructions for joining the AGM electronically are provided in the Notice of the AGM.

In compliance with the General Circular No.10/2022 dated December 28, 2022 read with earlier Circulars and subsequent circulars in this regard, the latest being General Circular No.09/2023 dated September 25, 2023 issued from time to time by the Ministry of Corporate Affairs and the SEBI Circular Dated October 7, 2023 read with earlier Circulars issued from time to time by the SEBI, the Company has sent the Notice of the AGM and the Annual Report 2023-24 on September 04, 2024 through electronic mode to all the members whose e-mail IDs are registered with the Company/ Depository Participant(s) Registrar and Share Transfer Agent. These documents are also available on the website of the Company at www.welspuncorp.com and on BSE Limited, National Stock Exchange of India Limited and the Calcutta Stock Exchange Limited at www.bseindia.com www.nseindia.com and www.cse-india.com respectively and on the website of the National Securities Depository Limited at www.evoting.nsdl.com. Members who have not registered their e-mail addresses are requested to register their e-

mail addresses with respective depository participant(s) and members holding share in physical mode are requested to update their e-mail addresses with Company's Registrar and Share Transfer Agent, Link Intime India Private Limited at rnt.helpdesk@linkintime.co.in. Ms. Mansi Damania (FCS:7447 CP:8120) or failing her, Mr. Jigar Shah (FCS: 8918 CP:13936) of M/s. JMJA & Associates LLP, Practicing Company Secretaries have been appointed as the Scrutinizer to conduct and scrutinize the voting by way of e-voting process in a fair and transparent manner.

Members holding share in physical form or dematerialized form, as on the Cut-Off Date i.e. Thursday, September 19, 2024, may cast their votes electronically on the business as set forth in the Notice of the AGM through the electronic voting system of NSDL ('remote evoting'). Members are hereby informed that:

- (a) The business as set forth in the Notice of the AGM may be transacted through remote e-voting and e-voting system at the AGM;
- (b) The remote e-voting will commence on Sunday, September 22, 2024 (9:00 a.m.) and end on Wednesday, September 25, 2024 (5:00 p.m.);
- (c) The Cut-Off Date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the AGM shall be Thursday, September 19, 2024;
- (d) Remote e-voting module will be disabled on Wednesday, September 25, 2024 after 5:00 p.m. i.e., remote e-voting will not be allowed beyond the said date and time;
- e) Members may note that the facility for voting will also be made available during the AGM, and those Members who will be present in the AGM through VC/OAVM facility and have not casted their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system at
- f) The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;
- (g) The voting rights of members shall be in proportion to their share of the paid-up equity share capital of the Company as on the Cut-Off Date of Thursday, September 19, 2024;
- (h) Any person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the notice and holds shares as of the Cut-Off Date i.e. Thursday, September 19, 2024, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or to the Company/Registrar & Transfer Agent. However, if you are already registered with the CDSL and NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote;
- (i) A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the Cut-Off Date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM; and
-) Members may contact Assistant Company Secretary at Welspun House, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400013, or email at CS_WCL@welspun.com or call on +91 (022) 6613 6430 for any grievance(s) relating
- to remote e-voting between 10:00 a.m. and 6:00 p.m. on any working day. All grievances connected with the facility for voting by electronic means may be addressed to NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 022

For Welspun Corp Limited Sd/

Assistant Company Secretary

Paras Shah

ACS: 30357

Mumbai, September 04, 2024

4886 7000:

SG MART

SG MART LIMITED

(Formerly known as Kintech Renewables Limited) CIN: L46102DL1985PLC426661

Regd. Office: H. No. 37, Ground Floor, Hargovind Enclave Vikas Marg, Delhi-110092 Corporate Office: A-127, Sector-136, Noida, Gautam Buddha Nagar, Uttar Pradesh-201305

Tel: 91-11-44457164 Website: www.sgmart.co.in Email: compliance@sgmart.co.in NOTICE TO THE MEMBERS FOR THE 39TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that 39th Annual General Meeting ("AGM") of the Company will be held on Saturday. September 28, 2024 at 11,30 A.M. through Video Conference ("VC") facility, as per the provisions of the Companies Act, 2013 "Act") and Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 "SEBI (LODR) Regulations") read with Ministry of Corporate Affairs ("MCA") Circular No. 20/2020 dated May 5, 2020 and Circular No. 14/2020, 17/2020, 02/2021, 02/2022, 10/2022, 09/2023 dated April 8, 2020, April 13, 2020, January 13, 2021, May 5, 2022, December 28, 2022 and September 25, 2023 respectively and Circular No. SEBI/ HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 2021. Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022. Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 07, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars"), without the physical presence of

In compliance withthe relevant SEBI and MCA Circulars, the Notice of the 39th AGM and Integrated Annual Report of the Company for the Financial Year ended on March 31, 2024, along with login details for joining the 39th AGM through VC facility including e-voting will be sent only by e-mail to all those Members, whose e-mail addresses are eady registered with the Company or the Registrar and Share Transfer Agent or with their respective Depo Participants ("DP"). Please note that the requirement of sending physical copy of the Notice of the 39th AGM and Integrated Annual Report to the Members have been dispensed with vide MCA Circular(s) and SEBI Circular(s). Members can join and participate in the 39th AGM through VC facility only. The instructions for joining the AGM are provided in the Notice. Members participating through VC facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. The Notice of the 39th AGM and the Annual Report will also be made available on Company's website (www.sgmart.co.in), Stock Exchanges' websites (www.bseindia.com) and on the website of National Securities Depository Limited ("NSDL") (www.evoting.nsdl.com). The physical copy of the Notice along with Integrated Annual Report shall be made available to the Member(s) who may request the same.

The Company is providing remote e-voting (prior to AGM) and e-voting (during the AGM) facility to all its Members to cast their votes on all the resolutions set out in the Notice of the 39th AGM. Detailed instructions for remote e-voting are provided in the said Notice. The facility of casting the votes by the members ("e-voting") will be provided by NSDL. The remote e-voting period commences on September 25, 2024 (9:00 A.M.) and ends on September 27, 2024 (05:00 P.M.). During this period, members of the Company, holding shares either in physical form or in dematerialized. form, as on the cut-off date of Saturday, September 21, 2024, may cast their vote by remote e-voting or by e-voting at the time of AGM. Members participating through VC / OAVM shall be counted for reckoning the guorum under

Members who have not registered their e-mail address with the Company or RTA, can register their e-mail address for receipt of Notice of 39th AGM, Annual Report and login details for joining the 39th AGM through VC facility including e-voting by sending a request to MCS Share Transfer Agent Limited, Registrar and Share Transfer Agent at mcsltdbaroda@gmail.com; mcsstaahmd@gmail.com. or to the Company at compliance@sgmart.co.in, by providing their name, folio number/DPID & Client ID, client master or copy of consolidated account statement (in the case of demat holding), copy of share certificate - front and back (in the case of physical holdings), self- attested scanned copy of the PAN card and self-attested scanned copy of Aadhar Card in support for registering e-mail address. n case of demat holding, please contact your DP and register email address and bank account details in your demat account, as per the process advised by your Depository Participant. Any person who acquires shares and becomes Member of the Company after the date of electronic dispatch of

Notice of 39th AGM and holding shares as on the cut-off date i.e. Saturday, September 21, 2024, may obtain the Login ID and Password by following the instructions as mentioned in the Notice of 39th AGM or sending a request at evoting@nsdl.co.in.

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evoting.nsdl.com, under help section or write an email to evoting@nsdl.co.in or call on. 022 - 4886 7000 and 022 - 2499 7000 Kindly note that pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/Pod-1/P/CIR/2024/37 Dated May 07, 2024, it has

been made mandatory for members holding shares of the Company in physical form, to furnish PAN and KYC details to the Company/ RTA. Members are also recommended to complete their nomination in the prescribed form. In this connection, the following forms are notified by SEBI, can be downloaded from the Company's website at

- Form ISR-1 (Request for registering PAN, KYC details or changes/ Updation thereof); Form ISR-2 (Confirmation of signature of Members by their bankers);
- Form SH-13 (Nomination form)

Place: Delhi

The Notice of AGM and Integrated Annual Report for financial year 2023-24 will be sent to members in accordance with the applicable laws on their registered email addresses in due course.

> For and on behalf of SG Mart Limited Sachin Kumar Company Secretary

AFLOAT ENTERPRISES LIMITED

(Formerly Adishakti Loha and Ispat Limited) Regd off: Plot3, Shop 325, DDA C.Cntr. Aggarwal Plaza, Sec-14, Rohini, New Delhi-110085 Phone: +91-9810260127, Email: info@adishaktiloha.com, website; adishaktiloha.com NOTICE OF AGM

Notice is hereby given that the 9th Annual General Meeting of the members of AFLOAT Enterprises Limited (Formerly Adishakti Loha and Ispat Limited) will be held on Monday September 30, 2024, at 12: 15 p:m. at "Metro Grill" 415, 4th Floor, Citi Centre Mall, Sector 10, Rohini, Delhi-110085 ("the Meeting").

The Annual Report for the financial year 2023-24 including the Notice convening the Meeting has been sent electronically to the members who have registered their e- mail address with the Depositories / Company and also sent to the members to their registered address by courier to those whose email- Id is not registered, and

The Annual Report for the financial year 2023-24 including the Notice is available on the website of the Company (www. adishaktiloha.com) and also available for inspection at the Registered Office of the Company on all working days except Sundays and Public Holidays, during business hours up to the date of the Meeting...

The Company is providing to its members facility to exercise their right to vote on resolutions proposed to be passed at the Meeting by electronic means ("evoting"). Members may cast their votes using an electronic voting system from a place other than the venue of the Meeting ("remote e-voting"). The Company has engaged the services of Central Depository Services Limited (CDSL) as the Agency to provide e-voting facility The communication relating to remote e-voting inter alia containing User ID and

password, along with a copy of the Notice convening the Meeting, has been dispatched to the members. . The formal of communication for e-voting is available on the website of the Company: www.adishaktiloha.com and on the website of CDSL. www.evotingindia.com. The remote e-voting facility shall commence on Friday, September 27, 2024 from 9:00 a.m. and end on Sunday September 29, 2024 at 5:00 p.m. The remote a-voting shall not be allowed beyond the aforesaid date and time.

A person, whose name appears in the Register of Members/ Beneficial Owners as on the cut-off date, i.e., Monday, September 23, 2024, only shall be entitled to avail the facility of remote e-voting /voting at the Meeting. Any person who becomes member of the Company after dispatch of the Notice of the

Meeting and holding shares as of the cut-off date may obtain the User ID and password inter alia by sending a request at helpdesk.evoting@cdslindia.com. The detailed procedure for obtaining User ID and password is also provided in the Notice of the Meeting which is available on Company's website and CDSL's website. If the members already registered with CDSL for e-voting, he can use his existing User ID and password for casting the vote through remote e-voting.

REGISTRATION OF EMAIL ADDRESS: Members who have not yet registered their email addresses are requested to register their email addresses. Members holding shares in demat form are requested to update the same with their Depository Participant and to Bigshare Services Private Limited ('RTA') for members holding shares in physical form. Member who have cast their vote(s) by remote a-voting may also attend the meeting but shall not be entitled to cast the vote(s) again RECORD DATE

NOTICE is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and applicable rules there under that the Company has fixed Monday, September 23, 2024 as the "Record Date" for the purpose of determining the members eligible to vote at the Annual General Meeting. For Affoat Enterprises Limited

Pawan Kumar Mittal Place: Delhi Director

(Formerly Adishakti Loha and Ispat Ltd)

DIN: 00749265

Date: 04/09/2024

(Formerly known as TRC Financial Services Limited) (CIN - L74899MH1994PLC216417) Registered Office: Bandra Hill View, CHS (3 rd Floor), 85 Hill Road, Opp Yoko Sizzlers,

AVASARA FINANCE LIMITED

Tel: 022 26414725, Email: trcfsltd@gmail.com, Website: www.trcfin.in Notice of Annual General Meeting

Bandra West, Mumbai – 400050

NOTICE is hereby given that the 30th Annual General Meeting ('AGM') of Avasara Finance Limited (Formerly known as TRC Financial Services Limited) will be held on Friday, September 27, 2024 at 12:00 noon through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") to transact the business, as set out in the Notice of the AGM only through e-voting facility.

The AGM will be held only through VC/OAVM in compliance with the provisions of the Companies Act 2013 and circulars dated 25" September, 2023, 28" December, 2022, 05" May, 2022, 14" December 2021, 13th January, 2021, 5th May, 2020, 8th April, 2020 and 13th April, 2020 issued by Ministry of Corporate Affairs and SEBI circular dated 05th January, 2023, 13th May, 2022, 15th January, 2021 12th May, 2020. Facility for appointment of proxy will not be available for the AGM. The instructions for joining the AGM electronically are provided in the Notice of the AGM.

Notice convening the AGM along with the Annual Report 2023-24 has been sent only through electronic mode (e-mail) on 04th September, 2024 to those members whose e-mail addresses are registered with the Company / RTA/ Depositories and will also be available on the Company's Website www.trcfin.in

Shareholders whose Email IDs are not registered with the Company/ Depository Participants, may follow the following process for registration of Email IDs before-voting at the AGM: (1) For Physical shareholders- please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) by email to support@purvashare.com (2) For Demat shareholders -Please update your email id & mobile no, with your respective Depository Participant (DP), (3) For Individual Demat shareholders - Please update your email id & mobile no. with your respective Depository Participant (DP) which is mandatory while e-Voting & joining virtual meetings

The Company is pleased to provide e-voting facility to all its Members to exercise their right to vote on the resolutions through E-Voting platform ("remote e-voting") as well as e-voting during the proceeding of the AGM ("collectively referred as e-voting") provided by Central Depository Services (India) Ltd.

The members whose names appear in the Register of Members / list of Beneficial Owners as on the cut-off date i.e. 20th September, 2024 are entitled to avail the facility of e-voting. Eligible members who have acquired shares on or after the dispatch of notices and upto the cut-off date may approach CDSL at helpdesk evoting@cdslindia.com for issuance of User ID and Password for exercising their right to vote by e-voting. Members are requested to follow the instructions available in the AGM Notice dated 12th August, 2024, which can also be downloaded from Company's Website www.trcfin.in

The e-voting period commences on Tuesday, 24th September, 2024 at 09:00 a.m. and ends on Thursday 26° September, 2024 at 5:00 p.m. (IST). The members will not be able to cast their vote after the said date. Any query or grievances connected with e-voting may be addressed to Mr. Rakesh Dalvi, Manager at CDSL at A-Wing, 25th Floor, Marathon Futurex; Mafattal Mill Compounds

N M Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013 or contact - 18002109911 or at email helpdesk.evoting@cdslindia.com Facility for e-voting shall also be made available during the AGM to those members who attend the AGM and who have not already cast their vote. The members who cast their votes by remote e-voting

prior to the AGM may also attend the meeting through VC/OAVM but shall not be entitled to cast their

Notice is also hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with applicable rules and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, 20th September, 2024 to Friday, 27th September, 2024 both days inclusive, for 30th AGM.

For Avasara Finance Limited (Formerly known as TRC Financial Services Limited) By Order of the Board of Directors

Sabarinath Gopala Krishnan

Date: 04th September, 2024

vote again

Whole-time Director

KACHCHH MINERALS LIMITED CIN: L15543MH1981PLC024282

Reg. Office: Shop No 16, S 2nd Floor, Sej Plaza, Marve Road, Nr Nutan Vidya Mandir School, Malad West, Mumbai - 400 064, Maharashtra, India. Email Id: kachhmineral@yahoo.in

Notice of 43rd Annual General Meeting and Remote e-Voting Information

Notice is hereby given that the 43rd Annual General Meeting ("AGM") of the Members of M/s. Kachchh Minerals Limited ("the Company") will be held on Monday, September 30, 2024 at

03:00 P.M. (IST) through video conferencing ("VC")/ Other audio visual means ("OVAM"), to transact the business as stated in the AGM Notice, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with relevant circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India, without the physical presence of the Members at The Annual Report of the Company for the F.Y. 2023-2024, including AGM Notice, Financial Statements,

for the year ended March 31, 2024 ("Annual Report") were sent through electronic mode only, on Wednesday, September 04, 2024 to all those members whose email ids are registered with Company or its Renistrar and Transfer Anent, M/s, Rinshare Services Private Limited or the Denositories accordance with the MCA circulars and the SEBI circulars. Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remate electronic voting or casting vate through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Annual Report for the F.Y. 2023-2024, including the AGM Notice is also available on the company's website www.kachchhminerals.com.and Bombay Stock Exchange Limited's ("BSE") website www.bseindia.com. Members holding shares in physical mode and who have not updated their email address with the

Company can obtain notice of the AGM, Annual Report and/or login details for joining the AGM through

VC/OAVM facility including e-voting by sending scanned copy of a) Copy of the signed request letter

mentioning the folio number, name and address of the member b) self - attested copy of PAN Card

and c) Self-attested copy address proof (eg.: Aadhar, Driving license, Election Identity Card, Passport) of the member by email to kachhmineral@yahop.in , eyoting@nsdl.co.in and The Company is pleased to provide remote e-voting facility to the members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said meeting. The facility of e-voting will also be made available at the AGM and members attending the AGM through VC/ OAVM, who have not cast their vote by remote e-voting, will be able to vote at the AGM. The company has

The facility of casting the votes by the Members ("e-Voting") will be provided by NSDL and the detailed procedure for the same shall be provided in the Notice of the AGM. The Remote e-voting shall commence on Friday, September 27, 2024 at 09:00 A.M. (IST) and conclude on Sunday, September 29, 2024 at 05:00 P.M. (IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date Monday, September 23, 2024 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by the NSDL for voting thereafter. The voting rights of Members shall be in proportion to their shares in paid up equity capital of the Company as on cut-off date i.e. Monday, September 23, 2024.

availed the services of NSDL to provide the facility of remote e-voting /e-voting at the AGM.

sending of the AGM Notice and holding shares as of the cut-off date may obtain login id and password by sending a request at evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting vote or following the procedure as mentioned in the AGM Notice.

carefully go through the same. Members, who need assistance before or during the AGM regarding e-voting, facility and or VC/ OAVM facility, can send a request at evoting@nsdl.co.in or use toll free Notice is also given that pursuant to section 91 of the Act read with Rules made thereunder and

> By Order of the Board of Directors of Kachchh Minerals Limited



GB GLOBAL LIMITED

(Formerly known as Mandhana Industries Limited) CIN: L17120MH1984PLC033553 Registered Office: 10th Floor, Dev Plaza, Opp. Andheri Fire Station, S. V. Road, Andheri (West), Mumbai - 400 058

Tel.: 022-40383838 Email: cs@gbglobal.in; Website: www.gbglobal.com 40th ANNUAL GENERAL MEETING OF GB GLOBAL LIMITED Members are requested to note that the 40th Annual General Meeting ('AGM') of GB Global Limited ("the Company") will be held on Monday, 30th September 2024 at 11.30 a.m. (IST) at the registered office of the Company situated at 10th Floor, Dev Plaza, Opp. Ándheri Fire Station, S. V. Road, Andheri (West), Mumbai

 400 058 to transact the business to be set out in the Notice of the 40th AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act"). Pursuant to the General Circular SEBI/HO/DDHS/P/CIR/2023/0164 issued by Securities and Exchange Board of India, electronic copies of the Notice of the 40th AGM, procedure and instructions for e-voting and the Annual Report for the Financial Year ended 31st March, 2024 have been sent via email, to all the Members whose email ids are registered with the Company / Registrar and Transfer Agent / Depository Participant(s). The Annual Report along with the Notice of the AGM, are also available on the website of the Company at www. Members having Demat Account and who have not yet registered their E-mail

E-mail Id's with their Depository Participant. Members having shares in physical form may register their E-mail Id's by sending an E-mail to Company's email id: cs@gbglobal.in or to the Company's Registrar & Transfer Agent, Link Intime India Private Limited, email id: rnt.helpdesk@linkintime.co.in mentioning their folio number. Members are requested to keep their E-mail Id's updated in the Demat account or with the Company as the case may be. Members holding shares either in physical form or dematerialised form, as on cut-off date i.e., Sunday, 22nd September, 2024, are entitled to appoint a proxy to

attend and to vote on behalf of member. Such a proxy need not be a member of

the Company. Proxies, in order to be valid and effective must be delivered at the

registered office of the Company duly filled and signed not later than 48 hours

Id's for receiving documents in electronic form are requested to register their

before the commencement of the meeting. In compliance with the provisions of Section 108 of the Companies Act. 2013 and the Rules made thereunder and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 as amended; all the Members

their vote by electronic means on the resolutions set out in the Notice of the The remote e-voting shall commence on Friday, 27th September, 2024

The Company is providing remote e-voting facility to its Members to cast

- The remote e-voting shall end on Sunday, 29th September, 2024 (05:00 p.m.
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting for
- Any person, who acquires shares of the Company and becomes Member of the Company after dispatch of Notice of 40th AGM along with Annual Report as on the cut-off date i.e., Friday, 30th August, 2024 but before remote e-voting cut-off date i.e., Sunday, 22nd September, 2024 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com. However, if he/she is already registered with NSDL for remote E-voting then he/she can use his/her existing User ID and password for casting vote. If he/she forgets his/her password, he /she can reset his/her password by using "Forgot User Details/Password" option available on www.evotingindia.com or contact NSDL at Toll Free No.: 022 - 4886 7000 and 022 - 2499 7000.
- In case of any grievances, queries or issues regarding remote e-voting process, Members may refer the Frequently Asked Questions ("FAQs") and remote e-voting manual available at www.evotingindia.com under help section or may contact Ms. Prajakta Pawle, National Securities Depository Limited (NSDL), TradeWorld 'A' Wing, Kamala Mills Compound, Lower <u>prajaktap@nsdl.com</u> or call on 022 - 4886 7000 and 022 - 2499 7000. The Company has appointed Mr. Himesh Pandya, Practicing Company

Secretary (Membership No.:40991) to act as a Scrutinizer, to scrutinise the remote e-voting process and poll process in a fair and transparent manner. Notice is hereby given that pursuant to the provisions of Section 91 of the Act read with the relevant Rules framed thereunder and Regulation 42 of the

Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Monday, 23rd September, 2024 to Monday, 30th September, 2024 (both days inclusive), for the purpose of 40th AGM.

For GB Global Limited

Dev Thakkar

Place: Mumbai Date: 04th September, 2024

Chairman

Lumax Auto Technologies Limited DK JAIN

Regd. Office.: 210 Floor, Harbans Bhawan-II. Commercial Complex, Nangal Raya, New Delhi – 110046, Tel No.: 011-49857832. E-Mail: shares@lumaxmail.com, Website: www.lumaxworld.in/lumaxautotech

NOTICE OF 43" ANNUAL GENERAL MEETING OF

CIN: L31909DL1981PLC349793

LUMAX AUTO TECHNOLOGIES LIMITED & E-VOTING INFORMATION NOTICE is hereby given that 43" (Forty Third) Annual General Meeting ("AGM") of the members of Lumax Auto Technologies Limited ("the Company") will be held on Friday, September 27, 2024 at 11:00 A.M. (IST) through Video Conferencing ("VC")/Other

Audio-Visual Means ("OAVM"), in compliance with the applicable provisions of the Companies Act, 2013 read with the circulars issued by Ministry of Corporate Affairs ("MCA") and Securities and Exchange Board of India ("SEBI"), to transact the business(es), as set out in the Notice of AGM, without physical presence of the Members at a common venue. The Company has sent the Notice of 43" AGM and Annual Report for the Financial Year 2023-24 only through electronic mode on Wednesday,

September 04, 2024 to Members whose e-mail addresses are

registered with the Depositories i.e., National Securities Depository

Limited ("NSDL") or Central Depository Services Limited ("CDSL")/

Registrar and Share Transfer Agent ("RTA") i.e., Bigshare Services Private Limited/the Company. Members may note that the aforesaid Notice and Annual Report for the Financial Year 2023-24 are also available on the website of the of the Company i.e. https://www.lumaxworld.in/lumaxautotech, on the

website of the Stock Exchanges i.e. www.bseindia.com and www.nseindia.com and on the website of NSDL at www.evoting.nsdl.com. Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20

of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and other applicable provisions of the Companies Act, 2013 and Regulation 44 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standard on General Meeting ("SS-2") issued by The Institute of Company Secretaries of India, the Company is pleased to provide facility to its members, to cast their vote on all the Resolutions set forth in the Notice convening the AGM using electronic voting system ("remote e-Voting"), provided by NSDL. The detailed procedure/instructions in this respect have been provided in notes to the Notice of AGM.

The members of the Company, holding shares as on the Cut-off date i.e., Saturday, September 21, 2024, may cast their vote electronically. The e-voting period shall commence on Tuesday, September 24, 2024 (09:00 A.M. IST) and end on Thursday, September 26, 2024 (05:00 P.M. IST). The e-Voting module shall be disabled by NSDL for voting after 05:00 P.M. (IST) on Thursday, September 26, 2024. Those who are not Members on the cut-off date should accordingly treat the AGM Notice for information purposes only. Once the vote on a resolution is cast by the member, he/she shall not be allowed to change it subsequently. The voting rights of Members shall be in proportion to the shares held by them in the total paid-up Equity Share Capital of the Company as on the Cut-off date. Members who have already cast their votes through remote e-Voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their votes again. Members attending the AGM who have not cast their votes through remote e-Voting shall be able to exercise their voting rights during the AGM.

Any person, who acquire shares and become member of the Company after dispatch of the notice and holding shares on the Cut-off date i.e. Saturday, September 21, 2024 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if you are already registered with NSDL for e-voting then you can use your existing user ID and password to cast your vote.

The Company has appointed Mr. Maneesh Gupta, Practicing Company Secretary, New Delhi (FCS No. 4982) as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner. Members, who would like to express their views or ask questions during

the AGM, may register themselves as a speaker by sending a request from their registered email address to shares@lumaxmail.com. mentioning their name, DP ID and Client ID, PAN and mobile number at least 7 days prior to the date of AGM i.e. by Friday, September 20, 2024 by 05:00 P.M. (IST). Only those Members, who have registered themselves as a speaker, will be allowed to express their views/ask questions during the AGM depending upon availability of time. The Company reserves the right to restrict the number of questions and number of speakers depending on the availability of time at the AGM.

Members who need assistance before or during the AGM with use of technology or in case of any queries or issues or grievances pertaining to e-voting, may please refer to Help/FAQ section/available at www.evoting.nsdl.com or call on toll free no. 022-48867000 or send a request at evoting@nsdl.co.in. Alternatively, Members may also write to the Company Secretary of the Company at the email ID: shares@lumaxmail.com.

> For Lumax Auto Technologies Limited Pankaj Mahendru

Company Secretary & Compliance Officer Place: Gurugram ICSI Membership No. A28161 Date: September 04, 2024

Chairman and Managing Director Date: September 4, 2024 Place: Mumbaifinancialexp.epapr.in

Date: September 05, 2024

Any person who acquires shares of the Company and becomes a Member of the Company after

The details and instructions for joining the AGM through VC/ OAVM and casting the vote through remote e-voting/ e-voting at the AGM is provided in the Notice of the AGM. Members are requested to

Regulation 42 of SEBI Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Monday, September 23, 2024 to Monday, September 30, 2024 (both days inclusive) for the purpose of Annual General Meeting.

> Daksh Narendrabhai Trivedi Director

40th AGM is Sunday, 22nd September, 2024.

दीनदयाल पत्तन प्राधिकरण दवाओं की आपूर्ति के लिए गांधीधाम, नया कंडला दानबदाल सरस्त प्राधकरण दवाजा का आधूत के लिए नापामान, बच कहरा, जाधियू, जानमान और वार्धीवार के मेहिकल स्टोर्स-दूवर विकंताओं से ईजी आधियू, जानमान और वार्धीवार के मेहिकल स्टोर-खुदरा विकेता अपने प्रस्ताव ईनेला (cmo@deendayalport.gov.in)/जीवृत डाक/व्यवित्तनत रूप से अस्ताव ईनेला (cmo@deendayalport.gov.in)/जीवृत डाक/व्यवित्तनत रूप से सिकाव डाक/व्यवित्तनत रूप से सिकाव डाक/व्यवित्तनत रूप से सिकाव डाक/व्यवित्तनत रूप से सिकाव डाक/व्यवित्तन रूप से सिकाव डाक/व्यवित्तन रूप से सिकाव डाक/व्यवित्तन का व्यवित्तन दीनवदाल परान प्राधिकरण अस्पताल, जीपालपुरी, जांधीधान (कच्छ) में जमा करा सकते हैं। अधिक जानकारी के लिए कृपया बेबसाइट : acendayalport.gov.in देखी मुख्य चिकित्सा अधिकारी दीनदयाल पत्तन प्राधिकरण

Welspun[®]Living વેલસ્પન લિવીંગ લિમિટેડ

(ભૂતપૂર્વ વેલવના ઇન્ડિયા લિમીટેક)
(ભૂતપૂર્વ વેલવના ઇન્ડિયા લિમીટેક)
(ભૂતપૂર્વ વેલવના ઇન્ડિયા લિમીટેક)
રહ્યું. હયેરી: વેલવના સિંદી, મામ વાયોગી, તા. અંભર , છું, કચ્છ, ગુજરાત-૩૦૦૧૦
દેશિ: ૧૯૧ ૨૦૩૬ દૂ૧૧૧૧, કેન્સ: ૧૯૧ ૨૦૩ - ૨૦૦૧૦
દોપી. હચેરી: વેલવના તહીરા, દુધી માળ, કમલાસિંદી, તેનાપતિ બાયર માગં, લોઅર
પરેલ (પશ્ચિમ), મુંહાઇ, મહાસાજ-૧૦૦૦ ૩ દેશિ: ૧૯ ૨૨ દૂ૧૧૩૦૦, ફેન્સ:
૧૧ ૨૨ ૨૪૯૦૦૦૦,
દેખીલ : companysecretary, will@welspun.com

નોદિસ તાથી આ નોદિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે, કંપન

ગાંદિસી આવી મારે સાંચાયલા કરવામાં આવે છે કે, હંપનીનાં સ્વયાની તે કર્યો વાર્ષિક સાયરલા કરવામાં આવે છે કે, હંપનીનાં સ્વયાની તે કર્યો વાર્ષિક સાયરલા કરવામાં આવે છે કે, હંપનીનાં સ્વયાની તે કર્યો વાર્ષિક સાયરલા કરવામાં અમા ('લોજીએ') મુસ્લાસ, ર સચ્ચેલ્ય, કરવાનાં સ્વયાને પર લક્કો કેમ્યુએએન મીક્યાનાં કર્યાં કરો હાંચતી મારે લીકિએ કોન્ફરનિસા ('વીસી') પ્રભાવ ઓક્સી વિજ્ઞાસનાં કર્યાં કરો હાંચતી મારે લીકિએ કોન્ફરનિસા ('વીસી') પ્રભાવ ઓક્સી વિજ્ઞાસનાં એક્યુએએન એક્યુએન એક્યુએએન એક્યુએન એક્યુએન એક્યુએન એક્યુએએન એક્યુએન એક્યુએએન એક્યુએન એક્યુએએન એક્યુએન એક્યુએએન એક્યુએન એક્યુ

સકલા. (જાાં) વીમી/જોએવીએમ દ્વારા એજીએમ શરૂ થયા પહેલાં રિમોદ ઇ-વારિંગ દ્વારા મનદાદ માર્ગ (જાાં) વીમી/જોએવીએમ દ્વારા એજીએ ક્યારા મનદાદ કરી શકાલો મહીં. (જ્) એજીએમ નીસિંગ અને રિમોટ કે 'વોર્ડિંગ પ્રક્રિયાલી વિસ્તારી ઇપ્તનીની લેઠનાશો પ્રતાનીની લેઠનાશો www.weispunliving.com તથા એનએસડીએલ www.evoting.nsdl.coi પ્રિપ્ક પ્રયુવનાએ

તમાં તે માંપી માટે છે. આ માર્ચ કરવાના ભાગવાના માત્રવાલના પ્રિકારના વિદ્યાલના પ્રાથમિત પ્ર







માપર–ચાંગડાઈ ગામના સીમ વિસ્તારમાંથી બે શિકારી પકડાયા

ક્રોડાય (તા. માંડવી), તા. ૪: તાલુકાના માપર-ચાંગડાઇ ગામના સીમ વિસ્તારમાં ગત રાત્રે ૧૨.૩૫ વાગ્યાના ગ્રુસામાં સસલાના શિકાર અર્થ નીકળેલા બે શિકારીને માંડવી વન વિભાગના કર્મચારીઓએ પકડી તેમની પાસેથી ટોર્ચ અને ધોકા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

.. પશ્ચિમ કચ્છ વન વિભાગના ડી.સી.એફ. યુવરાજસિંહ ઝાલા તથા આર.એફ.ઓ. એમ. આઈ.

Glogauro पत्तन प्राधिकरण DEENDAYAL PORT AUTHORITY (Ministry of Ports, Shipping & Waterways, Govt. of India) An ISO 9001: 2015 & ISO 14001: 2015 Certified Port

EOI (Expression of Interest) for supplying of Medicines

EOI (EXPression or Interest) To supplying of wiedlicines Deendayal port authority has been seeking EOI (Expression of Interest) from the Medical stores/Retailers for supplying of Medicines from the place of Gandhidham, New Kandla, Adipu., Jamaagar and Vadinar, Interested Medical stores/Retailers may su b m it the ir of fler s th r o u g h e m a il (cmo@deendayalport.govin)/registered post/by hand upto 5:00 PM by 18-09-2024 to CMO office, Deendayal Port Authority Hospital, Gopalpuri- Gandhidham-Kutch and for more information please visit the website: deendayalport.govin. Chief Medical Officer Deendayal Port Authority Deendayal Port Authority

Welspun વેલસ્પન ઇન્વેસ્ટમેન્ટસ એન્ડ કોમર્શિચલ્સ લિમિટેડ

નોટિસ

www.weispuninvestments.com क्ले लेखनल किकोसिटीज लिकिटे eventagement.com किस पिक्टम है। f) विगोद ज'नीर्डन संकरीती कोस्या पुरदेशी नहाम तो कंपनी लेखेरडी, को भारत, गेदान्यन विश्ते, त्याचा विज्ञे क्लांच्या के तो नहीं के कंपनी लेखेरडी, को भारत, उक्कार अपने क्लांच्या के तो क

(નામાનિ/કચ્છ/૫૧૦/૨૦૨૪-૨૫)

જાહેર નિવિદા

ગુજરાત સરકારશ્રી વન વિભાગ નાચબ વન સંરક્ષકની કચેરી, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ-કચ્છ. क्रोन नं. ०२८३२-२५०२२७. Email: defkachchheast@gmail.com ક્ચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ હેઠળ નીચેની રેન્જમાં ગૂગળ પ્રોજેક્ટ-૨૦૨૧-૨૨, હેઠળ અંતર્ગત કરવા

ારીખ :-3/૯/૨૦૨૪, ટેન્કર કોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૭/૯/૨૦૨૪, વિભાગીય કચેરી દ્વારા ટેન્ડ



માંડવી તાલુકાના માપર અને ચાંગડાઈ સીમ વિસ્તારમાં સસલાંના શિકાર અર્થે નીકળેલા શખ્સોને વન વિભાગ દ્વારા પકડી પડાયા ત્યારનું દૃશ્ય.

પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે માડવી નોર્મલ રેન્જના સ્ટાફ વનપાલ રામુભાઈ ગઢવી. વનરક્ષકો નવીન ચારણ અને શિવરાજ મંધુડાએ માપર ચાંગડાઈ ગામની સીમમાં રાત્રિના ૧૨.૩૫ કલાકે વન્ય જીવ સસલાંનો શિકાર થાય તે પહેલાં જ બે શિકારી ઈસમ મામદ હુસેન ઈબ્રાહીમ જત તથા સોહિલ ફકીરમામદ જત (બંને

હરિઓમ ટ્રસ્ટ સંચાલિત એમ.એમ. હોસ્પિટલ, આદિપુર

ફૂલટાઈમ મળશે બાળરોગ નવજાત શિશુ નિષ્ણાંત ડો. સાગર પટેલ (સલિયા) M.B.B.S, M.D. (પીડીયાટ્રીકસ) (૮ વર્ષના અનુભવી)

નવજાત શિશુથી માંડી ૧૮ વર્ષના તમામ બાળકોની તપાસ-નિદાન-સારવ નવજાત શિશુ માટે કાચની પેટીની સુવિન

(Level 3 NICU) NICU માં વેન્ટીલેટર, Bubble CPAP, ફોટો થૈરાપીની સવિદ્ય

ફાટો ઘેરપોની સુવિધા બાળકો માટે Pediatric ICUની સુવિધા બાળકોના શારીરિક-માનસિક વિકાસ આફાર, તમામ પ્રકારની સ્ત્રી, માહિતી અને માર્ગદર્શન સ્ટીકરણ કેન્દ્ર જનરલ વોર્ક, સેમી સ્પે. - સ્પેશ્થલ તથા કીલસ રૂમ, મેડીકલેઈમની સુવિધા

મબાગ રોડ. SRC ઓકિસ પાછવ આદિપુર - 70690 91451/52

આપની જાહેરાત આપવા સંપર્ક તહેરખબર વિભાગ, કરછમિત્ર કાર્ચાલ ઇન્દ્રાબાઇ પાર્ક પાસે, ભુજ વોટ્સ એપ/મોબાઈલ નંબર ૮૪૬૯ ૩૦ ૩૨ ૩૩

દેઢિયા)ને ઝડપી પાડ્યા હતા.

આ શખ્સો પાસેથી બે નંગ ટોર્ચ, બે નંગ ધોકાનો મુદ્દામાલ કબજે લઈ શિકાર અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વરસામેડીમાં અડધા લાખના **દારૂ સાથે શખ્યની ધરપકડ** ગાંધીધામ, તા. ૪ : અંજારના વરસામેડીમાં બાગેશ્રી

ટાઉનશિપ-પાંચમાં મકાનમાંથી પોલીસે મકાનનાથા નાવાસ અ. ૪૭,૮૬૦ના દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી. વરસામેડીમાં

ટાઉનિશિપ પાંચમાં આવેલા મકાન નંબર ૨૮૭માં પોલીસે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીના આધારે કાર્યવાહી કેરી હતી. મકાનમાં રહેતા લક્ષ્મણસિંહ સુલ્તાનસિંહ બાટીની ધરપકડ કરી પટી પલંગમાંથી સિબ્નેચર રેર, બ્લેન્ડર પ્રાઇડ, રોયલ સરેગ, રોયલ ચેલેન્જર, ઇમ્પિરીયલ બ્લયુ, મેજીક મુવમેન્ટની ૭૫૦ એમ.એલ.ની ૮૫ બોટલ તથા કિંગફિશર બીયરની ૬૫૦ મી.લી.ની ૨૪ બોટલ એમ કુલ્લ ચા ૪૭ /૬૦નો દાર પ્રસ્તગન રૂા. ૪૭,૮૬૦નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ દારૂ તેની પાસે ક્યાંથી આવ્યો હતો તે

Welspun'corp વેલસ્પન કોર્પ લિમિટેડ

(કોર્પોરેટ આઈકેન્ટીફિકેશન નંબર L27100GJ1995PLC025609) (સાધારક શાધકભ્યાસ્થવાલ નામકિ.) તા અંગમાર, ગુ. કર્યક, ગુજરાત-૩૦૦૧૦ રજી. ક્યેરી: વેલસ્પન સિટી, ગામ વર્ષામેડી, તા અંગર, ગુ. કર્યક, ગુજરાત-૩૦૦૧૦ ટેલિ: •૯૧ ૨૮૩૬ દૃદ્દરચર, ફેક્સ: •૯૧ ૨૮૩૬ રહેલ્ડ ફ કોર્પો. ક્યેરી: વેલસ્પન હાઉસ, કમલા મિલ્સ કંપાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ, મહારાષ્ટ્ર-૪૦૦૦૧૩ દેલિ. ૦૨૨ ૨૪૯૦ ૮૦૦૦, ફેક્સ: ૦૨૨ ૨૪૯૦ ૮૦૨૦.


વેલસ્પન કોર્પ લિમિટેડની રલ્મી વાર્ષિક સાધારણ સભા અંગે નોટિસ આથી આ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે, કંપનીના સભ્યોની રદમી વાર્ષિક સાધાર સભા ('એજીએમ') ગુરુવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના બપોરે ૩.૦૦ કલાકે એજીએ નોટિસમાં દર્શાવેલ કાર્યવાહી માટે વીડિયો કોન્ફરન્સ ('વીસી')/અન્ય ઓડિયો વિગ્રયુઅ

હેન્દર ઇનાઇઇમઇન્ડિયા પ્રાપંચિક (MH25 rnt.heippens.gmmn.mm. કર્યનીયા બિનારી છે. કંપનીએ એપ્લુંએમ દરમિયાના ઇ-વોડિંડગ પ્રક્રિયા પાસ્ટલાંક રીતે ચોપવ્યા માટે સ્કૃષ્ટિ કર્યો કુ.માનની દિવારી મારિકાઇ (FC5:74A7 CF93120) કે તેના વિભળે કી વિભર સા 1918 CP. 13956) મે જેએમએએ એન્ડ એમોલિયેક્ટર એબ્લોબર્સી, પ્રેટલીક્ટર કંપનીની 62-ઓફ લાઇપન સુધ્યાર, ૧૬ સ્વારેબર, ૨૦૨૪ના એપ પ્રવાસ કે ક્લિક્ટિસ કંપનીની 62-ઓફ લાઇપન સુધ્યાર, ૧૬ સ્વારેબર, ૨૦૨૪ના એપ પ્રવાસ કે ક્લિક્ટિસ વર્ષો એપાસની એપાસના કે ક્લિક્ટિસ કર્યો

ાર્મિકાના અમુક્તામાં દાગોલી કાર્યવાથી માટે એનાએલકીએલ તુલા ('મિકો કં મોર્ડિંક') પહુલિસી લિક્ફોનિક શર્ચ મતાના હરી શકશે. સ્થાયોને આવી વ્યવસ કરવામાં છે. તે. (લે) એલુએને નોરિકામાં દાગોલેલ શાર્ચવારી માટે માત્ર મિશેક ઇ-લોર્ડિંગ અને ઇ-લોર્ડિંગન (લે) એલુએને નોરિકામાં દાગોલેલ શાર્ચવારી માટે માત્ર મિશેક ઇ-લોર્ડિંગ અને ઇ-લોર્ડિંગન માત્ર મા

જાણ તારાખ નાધાયલ લશ તમાં જ એપ્રુએમ દરમિયાન રિમોર્ટ ઈ-વોર્ટિંગ હેર્ડ –વોર્ટિંગ કરવામાં મેં હકાદન કપાશો. એપ્રુએમ દરમિયાન રિમોર્ટ ઇ-વોર્ટિંગ સંબંધિત કોર્ડપણ મુજેલી જણાય તો ઇપની સેકેટરી, લસ્પાન લોધા, કબલા બિલા કંપાઇન્ડ, ત્રેનાપતિ ભાષ્ટ માર્ગ, લોધ્ય પરેલ, પૂર્વાઇ-૧૦૦ વચ્ચે અથવા CS WC@webpun.com & નર્લ (૨૨૬) દર્દિક દૂ ૪૩૦નો કામકાજના દિવસોએ સવારે ૧૦.૦૦થી સાંજે ૬,૦૦ દરમિયાન સંપર્ક સાધી

આસિસ્ટન્ટ કંપની સેક્રેટર્ર



PPOINTMENTS /

WALK IN INTERVIEW Кमिथ्डह

Electrician 1 • Store Keeper 1

Night Duty Manager 1

Mango

अपोधन्टमेन्ट અઠવાડિયામાં **ત્રણ દિવસ** Interview Date 7th Sept Time 10:30 am to 2 pm સાંભવાર ભાવ B/W ગુરુવાર ગ્રી. 3 દ 0/-પ્રતિ કો. સે.મી. Biodegradables LLP ં વધુ માહિતી માટે સંપર્ક : દેરખબર વિભાગ, કરછાયેન વર્લ્ડ Plot No.3, Survey No.156/Paiki-Vill. Varsana, Tal. Anjar-Kutch.

VEERAYATAN INSTITUTE OF

તત્કાલ જોઈએ છે Assistant Lecturer (BCA) Minimum Qualification required :

MCA/MSC IT/ BE (IT, COM.) with 55% and must have cleared NET/SLET/SET **ઈલેક્ટ્રીશિયન** (રહેવાસી) 3 ફેસ વીજળી લાઈનનો અનુભવ ધરાવત

કોમ્પ્યુટર ઓપરેટર (ક્લાર્ક) MS Officeમાં નિષ્ણાત

• ગાર્ડનર (માળી) બાગ-બગીચાનાં કામના અનુભવી

લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે રૂબરૂ મુલાકાત કરવી અથવા 🖂 veerayatan.hrd@gmail.com પર ઈ-મેઈલ કરવું. For further details, please Contact: Mo. 96629 26960 Jakhania, Bhuj-Mandvi Road, Taluka Mandvi-Kutch.



वैंक ऑफ़ बड़ीदा Bank of Baroda पहेली भाण, धनराष બिલ્डीંગ, કोलेष रोड, लूष - કચ્છ ३७० ००१.

ક્ચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ

સ્થાવર મિલ્કતના વેચાણ માટેની વેચાણ નોટિસ (એપેન્ડીક્સ - ૪ - એ) (નિયમ ૮(૬)ના વંચાણ ફેઠળ)

(એપન્ડીકસ - ૪ - એ) (નિયમ ૮(૬)ના વંચાણ હેઠળ)

દી સિક્યોરિટાઇડેશન એન્ડ રિકન્સ્ટ્રકથન એક ફાર્મનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ એક સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ સાલે સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ, ૨૦૦૨ ના નિયમ ૬(૨) અને ૮(૬)ના વંચાણ હેઠળ સ્થાય / ઇન્મ કરિયા છે. કેઇ સ્થાય કરે અને સ્થાય કરે સ્થાય કરે અને સ્થાય કરે સ

5H	સીક્યોર્ડ કેડીટર (શાખા) નું નામ અને ઉદ્યારકર્તા/ઓ
d.	અને જામીનદાર/ઓ/મોર્ગેજર/ઓનાં નામ અને સરનામ
	N.M. auf au autoform au annu

પશ્ચિમ દુકાન નં. ઝ? રાજીવ પ્રમાગકાશ કોશરના નામની બધા ભાગ અને અંધ સહિતની રથાવર મિલ્કત : જે ઓફીસ નં. ૧૫ લખ્યા ૧૫ ૮, પહેલો માળ, પ્લોટ નં. પ. ૧, ૧ અને ૨૧, ૧૩, ૧૫, લગ્ન બીઝનેલ મેસ્ટર, રે.સ. નં. ન્રજ પ. પ., ગામ ૧૫ડાલા, ગાંધીદામાં, એરસારએ ગાંધીદામાં, છે. સ્ટલ ખાતે સ્થિત છે. દુલા જગ્યાનું નામ ૧૫ ૯૫, ૧૪૯ સ્તર્ક માર્ટે સ્થિત (મિલ્ડલમ બીજાને પ્રમુ ત્યાર પ્લાસ અંધાર ક્લાન અંધાર પ્લાસ ૧૫ લાગ સ્થાસ ૧૫ લાગ સથ્યા સ્થાસ

રૂા. ૧,૦૦,૭૫,૨૭૫.૦૦ અને કોન્ટ્રાકચ્યુઅલ દરે લાગુ તેના ઉપરનું વ્યાજ + ખર્ચા, ચાર્જીસ અને સંપૂર્ણ રકમની ચૂકવણીની તારીખ સુધીના ખર્ચાઓ

બાકી લેણાં (રૂા. માં)

5th 10.00 PM Stree 2

સિકયુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૯ (૧) હેઠળની ૧૫ દિવસની વૈદ્યાનિક નોટિસ









બીકેટી દ્વારા ગડા નજીક આવેલા કલ્યાણેશ્વર મંદિરના શેડનું લોકાર્પણ અંજારમાં પોલીને બચાવેલા અબોલજીવોને પાંજરાપોળ મુકાયા

તરફથી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત

ગડાની સીમમાં આવેલા કલ્યાણેશ્વર મંદિર ખાતે શ્રાવણી સોમવતી અમાસના પાવન દિવસે કુલ રૂ.

दीनदयाल पत्तन प्राधिकरण

DEENDAYAL PORT AUTHORITY

(Ministry of Ports, Shipping & Waterways, Govt. of India)

An ISO 9001: 2015 & ISO 14001: 2015 Certified Port

EOI (Expression of Interest) for supplying of Medicines

Deendayal Port Authority has been seeking EOI (Expression of

Interest) from the Medical stores/Retailers for supplying of Medicines

from the place of Gandhidham, New Kandla, Adipur, Jamnagar and

Vadinar. Interested Medical stores/Retailers may submit their offers

through email (cmo@deendayalport.gov.in)/registered post/by hand

upto 5:00 PM by 18-09-2024 to CMO office, Deendayal Port Authority

Hospital, Gopalpuri- Gandhidham- Kutch and for more information

दीनदयाल पत्तन प्राधिकरण

DEENDAYAL PORT AUTHORITY

(पत्तन, पोत परिवहन और जलमार्ग मंत्रालय, भारत सरकार)

आईएसओ 9001: 2015 एवं आईएसओ 14001: 2015 प्रमाणित पत्तन

दवाओं की आपूर्ति के लिए ईओआई (रुचि की अभिव्यक्ति)

दीनदयाल पत्तन प्राधिकरण दवाओं की आपूर्ति के लिए गांधीधाम, नया कंडला, आदिपुर, जामनगर और वाडीनार के मेडिकल स्टोर्स/खुदरा विक्रेताओं से ईओआई

(रुचि की अभिव्यक्ति) आमंत्रित करता है। इच्छुक मेडिकल स्टोर/खुदरा विक्रेता

अपने प्रस्ताव ईमेल (cmo@deendayalport.gov.in)/पंजीकृत

डाक/व्यक्तिगत रूप से 18-09-2024 तक शाम 5:00 बजे तक मुख्य चिकित्सा

अधिकारी का कार्यालय, दीनदयाल पत्तन प्राधिकरण अस्पताल, गोपालपुरी,

गांधीधाम (कच्छ) में जमा करा सकते हैं। अधिक जानकारी के लिए कृपया

please visit the website: deendayalport.gov.in

वेबसाइट: deendayalport.gov.in देखें।

શ્રી રૂદ્રમાતા પિચત સહકારી મંંડળી લિ.

(મુ.પો. લોરિયા, તા. ભુજ-કચ્છ) રજિ. નંબર K.T.H. ખે (પી) ૩૧૮૦ પ્રમુખશ્રી, : હઠુભા બી. જાકેજા H). 68558 68000 (61400 66440)

મિટિંગ જાહેરાત

આથી રૂદ્રમાતા મંડળીની ખાસ સાધારણ સભા લોરિયા મઢી ખાતે તા. ૧૦/૯/૨૦૨૪, મંગળવારના સાંજે ૪:૦૦ કલાકે નીચેન એજન્ડા માટે મિટિંગ રાખવામાં આવેલ છે. જેમાં મંડળીના સભાસદ ભાઈઓને હાજર રહેવા વિનંતી..

🗏 મિટિંગના એજન્ડાઃ 🗮

- (૧) ગત મિટિંગની બહાલી
- (૨) નાણાકીય અહેવાલ રજૂ કરવા અંગે. (3) કેનાલો અને આઉટના રિપેરિંગ કરાવવા અંગે.
- (૪) પ્રમુખ સ્થાને જે રજૂ થાય તે.

,૬૦,૦૦૦ના અનુદાનથી શેડનું લોકાર્પણ કરવામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગડા નજીક આવેલું પ્રખ્યાત અને પવિત્ર કલ્યાણેશ્વર મંદિરથી સૌ કોઈ પરિચિત હશે. આ સ્થાન આસ્થાનું પ્રતિક છે. અહીં વિવિધ ધાર્મિક પ્રસંગો અને તહેવારોની ઉજવણી થતી હોય છે અને ઘણા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ બધીજ પ્રવૃત્તિઓને વધુ સારી રીતે પાર પાડવા માટે આ વિશાળ શેડ ખૂબ ઉપયોગી નીવડશે. આ કામ માટે બીકેટી કંપની તરફથી

સીએસઆરની કામગીરી અંતર્ગત

Chief Medical Officer

Deendayal Port Authority

રૂ. ૬,૬૦,૦૦૦અનુદાન કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ અતિથિ વિશેષ એવા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું. ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જયારે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત શાસક પક્ષના સદસ્ય હરિભાઈ હીરાભાઈ જાટીયા સહિત આગેવાનોની ઉપસ્થિતમાં ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગમાં અગ્રણીઓ કિસાન સંઘના પ્રમુખ કરમણભાઈ ગાગલ, કુકમાં સરપંચ રસિલાબેન રાઠોડ, ઉપસરપંચ ભરતસિંહ સોઢા,

B SALE BID

ફતેહગઢ પાસેની નર્મદા કેનાલમાં ડૂબી

જવાથી યુવાનનું મૌત રાપર : તાલુકાના ફતેહગઢ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત થતાં પરિવારમાં અરેરાટી છવાઈ જવા પામી હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ૨૨ વર્ષિય દિનેશ જેઠા બુચિયા નામનો યુવાન અગમ્ય કારણોસર કેનાલમાં પડી જતાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ૯ કલાક સુધી શોધખોળ કર્યા બાદ દેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

બે શિકારી ઝડપાયા

પેટ્રોલિંગમાં હતી, ત્યારે લાઈટનું અજવાળુ જોવા મળતાં શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં દેઢિયા ગામમાં રહેતા મામદ હુસેન ઈબ્રાહીમ જત અને સોહિલ ફકીરમામદ જત મળી આવ્યા હતા. શરૂઆતમાં ગલ્લા તલ્લા કર્યા બાદ પુછપરછ કરતાં સસલાનો શિકાર કરવા માટે આવ્યા હોવાની કેફીયત આપી હતી. આરોપી પાસેથી બે ટોર્ચ, ધોકા સહિતનો મુદામાલ કબ્જે કરી વન વિભાગમાં શિકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ભુજ : તાલુકાના માધાપર વિસ્તારમાં જુગાર રમતા ્૪ ખેલી ઝડપાયા હતા. જેમાં હિરેન મોરારજીભાઈ સોની, અંકુર લગધીર સોલંકી, દિનેશ જયંતીલાલ સોની અને જયદીપ સૂર્યકાંતભાઈ સોનીને ઝડપી રોકડા રૂપિયા ૧૧,૭૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા.

માંડવીના ચાંગડાઈમાં

માંડવી : તાલુકાના માપર - ચાંગડાઈ સીમમાં બે શખ્સો શિકારી પ્રવૃતિને અંજામ આપે તે પહેલા દબોચી લેવાયા હતા. મંગળવારે રાત્રે વૃત્ત વિભાગની ટીમ

માધાપરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

નવાવાસમાં મલવાડી

Manufacturer of Stainless Steel Welded and Seamless Pipes | Tubes | U-Tubes

मुख्य चिकित्सा अधिकारी

दीनदयाल पत्तन प्राधिकरण

WE ARE HIRING - WALK IN INTERVIEW Open Position for our Manufacturing Plant at Dhaneti Tal. Bhuj Kutch.

Department	Process	Skills	Designation	Qualification	(in Years)	Salary Range
Quality Assurance, Quality Control, Quality System Pre- Hyd	Documentation	Knowledge of QA/QC Doumertation related to IMS requirements for QS. Technical knowledge of Codes and Studard related to SS pipes & relevent documentation. Tender enquiry.	Sr. Engineer	Diploma (Mech.)	5 to 7	35,000/- to 45,000/-
			Engineer		3 to 5	30,000/- to 40,000/-
			Sr. Executive	BSc. (PCM)/ Any Graduate	5 to 7	20,000/- to 25,000/-
	-	Basic Knowledge of Computer	Jr. Executive		1 to 3	18,000/- to 22,000/-
	Quality Lab	Profiency in Chemical, Mechanical & Metallurgical testing for SS Pipes & Tubes. its documentation wrt NABL 17025 requiments.	Engineer	Diploma (Mech.)	3 to 5	20,000/- to 30,000/-
	Inspection Visual and Dimensional in Visual and Dimensional in	Visual/Dimensional inspection of Pipes.	Inspector	B.Sc./HSC/ITI		20,000/- to 35,000/-
		Handling third party inspections.	Supervisor	Diploma/B.SC		25,000/- to 40,000/-
		Visual and Dimensional inspection of Pipes.	Checker	SSC/HSC/ITI		18,000/- to 30,000/-
			PMI Operator		2 to 5	18,000/- to 25,000/-
		Visual and Dimensional inspection of Pipes. Preparing & Maintaining QC Documentation	Jr. Engineer	Diploma (Mech.)		18,000/- to 22,000/-
	Pre-Dispatch	Montoring of Pre-dispatch activities.	Inspector	SSC/HSC/ITI		20,000/-to 35,000/-
	Hydro Testing	Hydro Testing of pipes and Tubes.	Operator	SSC/HSC/ITI	2 to 5	15,000/- to 20,000/-
	Non Destructive	Handling the RTR testing & its documentation.	Supervisor	Diploma (Mech.)	5 to 7	25,000/- to 35,000/-

For all the above position we are looking candidate preferably from ss/cs pipe manufacturing units.

Attend an interview with the latest resume, a passport size photograph, curriculum documents, and work experience documents along with latest salary slip/proof of salary

Operation of RTR Machine

Interview (Date & Venue)

Share Your Resume

7th & 8th Sept 2024 | 9:30am to 5:00pm Hotel Fun N FOOD Plot No.29. Rabindranath Tagore Rd,

Facility & Benefits

SSC/HSC/ITI

SSC/HSC/ITI

Free Bachelor Accommodation medical Insurance, Subsidized Fcod & Bus faciltiy - Bhuj - Madhapar - Anjar.

5 to 7

2 to 5

recruitments@venuspires.com www.venuspipes.com

fin X ► Nenuspipes

25,000/- to 35,000/-

20.000/- to 30.000/-

દેવજીભાઈ આહિર, ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સહમંત્રી કિશોરભાઈ જોલાપરા, મંદિરના પૂજારી કૈલાશગિરિ ગોસ્વામી સહિતના મંચસ્થ રહ્યા હતા. અગ્રણીઓ ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, બીકેટી કંપની સામાજિક જવાબદારી ઉત્તમ રીતે નિભાવી રહી છે આસપાસના વિસ્તારના ગામ અને આસપાસના સામુદાયિક સ્થળોએ આ પ્રકારના લોકોપયોગી વિકાસથી સુવિધાઓમાં વધારો થાય છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ બીકેટીના અનુદાનની સરાહના કરી હતી તેમજ વધુમાં જણાવ્યુ હતું કે, આ શેડ અનેક કાર્યક્રમોમાં ઉપયોગી નીવડશે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે બીકેટીની કામગીરી વરચંદે બીકેટીની કામગીરી બિરદાવતા કહ્યું હતું કે, ખાનગી ઉદ્યોગએ સ્થાનિક ક્ષેત્રે વિકાસ

કર્યો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હરિભાઈ જાટીયાએ આ સરસ શેડ બનાવ્યો એ બદલ સીએસઆર ટીમ અને કંપનીનો આભાર માન્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, સરકારની કામગીરીમાં જે કામ નથી આવતાં એવાં કામો માટે કંપનીઓ આગળ આવી લોક

ઉપયોગી બની રહે છે. બીકેટી કંપની વતી ડી.બી. ઝાલાએ બીકેટી કંપની દ્વારા વિકાસના કામો કરવા માટે મંજૂરી આપવા બદલ કંપનીના મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. મનજનન્દ્રના આભાર માન્યા હતા. અને ધાર્મિક સ્થળે સૌના જોડાણ અને ટીમવર્કને બિરદાવ્યું હતું. બીકેટી કંપની તરફથી એજીએમ ડી.બી. ઝાલા, સીએસઆર અને લાયઝનના સિનિયર ઓફિસર ડી. ડી. રાણા અને નટુભા પરમાર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રવજીભાઈ ચાવડાએ અને આભારવિધિ દિનેશભાઈ ગજજરે કરી હતી.

Welspun वेलस्पन ઇन्पेस्टमेन्ट्स खेन्ड होमर्शियस्स क्षिमिटेड (કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર - L52100GJ2008PLCO55195)

રજી.કચેરી : "વેલસ્પન સિટી", ગામ વર્ષામેડી, તા. અંજાર, જિ. કચ્છ, ગુજરાત-૩૭૦૧૧૦, ભારત રેલિ. નદા ૧૯૩૩-૬૧૧૧૧ ફેક્સ નદા ૧૯૩૩-૬૧૧૧૧ હેલા નદા ૧૯૩૬-૧૯૦૧૦ હ-સેલ CompanyGeretary, Whit (Bwelspur.com, સ્વન્સાદ: www.welspurinivestrents.com કોમી. કમેદી : વધાના હાઉસ, તમો માત્ર, કમારા સી.દે સમાવી લાયા સમાં, લીગર પોરંપ, (પશ્ચિમ), મુંલઈ - ૧૦૦૦૧૩ ટેલિ : +૯૧ ૨૨ - ૧૭૧૩૩૦૦૦ ફેક્સ : +૯૧ ૨૨ - ૨૪૯૦૮૦૨૦

नो हिस

ગાંદિસ કાર્ય જાણ કરવામાં આવે છે કે, વેલસ્પન ઇલ્વેસ્ટમેન્ટસ એન્ડ કોમર્શિયલ્સ (તિમિડેડ (ધી કંપની)ના સભ્યોની ૧૬મી વાર્ષિક સાધારણ સભા શુક્લાર, ૨૭ સપ્ટેમ્બર, ૧૦૨૧ના રોજ કંપનીની દર્જા કરોરી વેલસ્પન સિટી, ગામ વર્ષોમેડી, તા.અંજાર, જિ.કરછ, ગુજરાત-૩૦૦ ૧૧૦ આતે વચારે ૧૧,૦૦ કલાકે એજીએમ નોટિસમાં શાંધિલ કાર્યવાદી મોડે યોજવામાં આવશે. કંપનીએ જ સપ્ટેમ્બર, ૧૦૧૪ના રોજ રિજસ્ટમાં શાંધિલ કાર્યવાદી મોડે કંપની ધારો, ૧૦૧૩ની કલામ ૧૦૮ની જોગવાઈ અને કંપની (મેનેજમેન્ટ એન્ડ એડિસ સરસામો એજીએમ નોટિસ મોકલી આપતી છે. કંપની ધારો, ૧૦૧૩ની કલામ ૧૦૮ની જોગવાઈ અને કંપની (મેનેજમેન્ટ એન્ડ એડિમીનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ અને સેબીના દરાવ ૪૪ (લિસ્ટિંગ ઓબ્લિંગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્લાયસ્ટેમેન્ટસ) નિયમો, ૧૦૧૫ વંચાણે લાફેન કંપનીએ એજીએમ નોટિસ મોડેની કાર્યવાદી અને મતદાન કરવા માટે ઇલિફ્રીનેક વર્ચિક (સિમ્પેડ ઇન્પીર્ટર) મુધ્યો મોડીની કાર્યવાદી અને મતદાન કરવા મોટે ઇલિફ્રોનેક વર્ચિક (સિમ્પેડ ઇન્પીર્ટર) મુધ્યો અપનાવેલી છે અને સ્ટ્રાફ્રીનાઈઝર તરીકે શ્રી સુનીલ ઝોરે, મે એસપ્પીઝેડ એન્ડ એસોસિમેટ્સ, ઇપની સિસ્ટરી, મુંબઈ નિયમેશક કરી છે.

રિમોટ ઈ-વોર્ટિંગ પ્રક્રિયાની વિગતો નીચે મુજબ છે:

- રિમોટ ઈ-વોર્ટિંગ પ્રક્રિયાંના વિગતા નીંચ મુજબ છ:

 (એ) રિમોટ ઇ-વોર્ટિંગ મંત્રગળવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સવારે ૯-૦૦) કલાકે શરૂ થશે અને ગુરુવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ (પ.૦૦) કલાકે લંધ થશે.

 (બી) રિમોટ ઈ-વોર્ટિંગ મોક્યુલ ગુરુવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ (પ.૦૦) કલાકે લિનકાર્યરત થશે અર્દાત ત્યાર પછી રિમોટ ઈ-વોર્ટિંગ શક્ય થશે નહીં.
 (સી) કંપનીનાં કર-ગોક, તારીએ શુંકવાર, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના પેઇક-અપ ઈન્ડિય્ટેં શેયમુંકીનાં પ્રમાણમાં શેર ધરાવનાર સભ્યો મતદાન માટે કક્કદાર રહેશે.
 (કી) એજીએમ નીટિંસ મોકલાચા બાદ સભ્ય બનેલ ક્ષેત્ર અને કંપનીની કર-એફ તારીએ અર્થાર્થાત્ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના શેરધારકો evoting@nsdi.co.in અથવા CompanySecretary WINL@welspun.comને વિનંતી કર્ચેથી આઇડી પાસાવર્ડ મેળવી શકશે. જ્યારે અગાઉથી નોંધારેલ સભ્યો પોતાના પ્રવર્તમાન પાસવર્ડ ક્રારા મતદાન કરી શકશે.
- પાસવડ મળવા શકા. જ્વાર અગાળવા નાધાવાલ સભ્યા પોતાના પ્રવતમાન પાસવડ મુક્તમ તદાન કરી શકો. જે વ્યક્તિમાન અને કર્યો કરો છે. એક તારીએ નોંધાયેલ હશે તેઓ સિમેટ ઇ-વોર્ટિંગ (વોર્ટિંગ બેરિટ પેપર હ્વાર પણ એજીએમાં બાગ લઈ શકશે. બેરિટ પેપર હ્વાર પણ એજીએમાં લોઇ હશે કરે ઇ-વોર્ટિંગ હરેટ પેપર હવા એજીએમાં દર્શની છે અને સિમેડ ઇ-વોર્ટિંગ હતા રેપર સ્વાર્ટિંગ હતા સ્વર્ટિંગ હ
- રહી શકશે, પરંતુ ફરીથી મતદાન કરી શકશે નહીં. (એચ) એજીએમ નોટિસ તથા રિમોટ ઇ-વોર્ટિંગની પ્રક્રિયા કપનીની વેબસાઇટ ents.com अने नेशनस सिड्योरिटीक विभीटिड
- www.welspunirvestments.com અને નેશનલ સિક્યોરિટીઝ (વિમીટેડ evoling@nsdl.co.in ઉપર ઉપલબ્ધ છે. (આઇ) સ્મિટિડ વેચિંગ સંબંધી કોઇપણ મુશ્કેલી ગણાય તો કંપની સેકેટરી, અમે માળ, વેલસ્પન કાઉએ, કાલા મિલ્સ કંપાઉલ્ડ, સેનાપતિ ભાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબર્ઇ- ૪૦૦૦૧૩ અથવા CompanySecretary_WNL@welspun.com +૯૧ (૦૨૨) ૭૬૧૩૬૦૦૦ની શાંત્રિયાર અને રેવિયાર સિવાયના કોઇપણ કામકાજના ટિવસોએ સવારે ૧૦.૦૦થી સાંજે ૧.૦૦ દરમિયાન સંપર્ક સાધયો.

વેલસ્પન ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ કોમર્શિયલ્સ લિમિટેડ

મુંબઈ, ૪ સપ્ટેમ્બર, ૨૦૨૪

Welspun[®]CORP વેલસ્પન કોર્પ લિમિટેડ

કોર્પોરેટ આઇડીન્ટીફિંશન નંબર L27100G.1995PLC025609 રજી. કચેરી : વેલ્સ્પન સિટી, ગમ પર્યામેડી, તા.અંજાર, જી.કાટક, ગુજરાત- ૩૭૦૧૧૦ ટેલિ : +૯૧-૨૮૩૬ ૬૬૧૨૧૨, ફેલ્સ : -૯૧ ૨૮૩૬ ૨૭૯૦૬૦ કોર્પો. કચેરી : વેલપન કાઉસ, કાલા સિલ્સ કાંપોલ્ડ, સેનાપરિ ભાપર માર્ગ, લીઅર પરેલ, મુંબઈ, મહારાષ્ટ્ર-૪૦૦૦૧૩ ટેલિ. ૭૨૨ ૨૪૯૯ ૮૦૦૦, ફેલ્સ : ૦૨૨ ૨૪૯૦ ૮૦૨૦. cretary_WCL@welspun.com www.we

વેલસ્પન કોર્પ લિમિટેડની ૨૯મી વાર્ષિક સાધારણ સભા અંગે નોટિસ

ખાથી આ નોટિસ હારા <mark>જાણ દરવામાં આવે છે કે, કંપનીના સભ્યોની</mark> રહમી વાર્ષિક સાધારણ સભા ('એઝએમ') સુરવાર, ૧૬ નહેનાના સભ્યાના સ્ક્રિમી વાર્ષિક એઝએમ નોટિસમાં દર્શાવેલ કાર્યવાદી માટે વીડિયો કોન્દરન્સ ('વીસી') અન્ય ઓડિયો વિઝ્યુઅત મીન્સ ('એએવીએમ')નાં માદ્ર્યમાર્થી ઇ-વોરિંગ સુવિધા ક્રારા જ ચોજવામાં આવશે.

ચોજવામાં આવશે. ચેજું અને તે અંબપાનન તે ના નાવતા છે ખાવઝ નુપાન્ય કાર્યા સાથે વે ચોજવામાં આવશે. એજીએમ કંપની ઘારો, ૨૦૧૩મી જોગવાઈ અને કોપોરેટ મંત્રાલયના પરિપત્રો તથા સંબીના વખતીવપત સુધારેલા નિચમો અનુસારા વીસી/ ઓડિયો વિઝ્રચુઅલ મીન્જ કારા સંતરાન કરી શકાયે. કોઈપણ સંખ્યોન પ્રોક્સની નિમણ કરી શકાયે નથી. ઇતિકટ્રોનિક રાહે સતદાનની સ્થળી વિગતો એજીએમ નોટિસમાં દર્શાવેલી છે. તા. ૨૯ ક્સિમ્બર, ૨૦૨૨ના સામાસ્ય પરિપત્ર ને ૧૦,૧૦૨૦ન જો ને આપીલ સંખીત્ર પરિપત્ર વેચાણો લાઇની અખત્ર સંસ્તરાન પરિપત્ર તથા સંબીત પરિપત્રને વેચાણો લાઇને કંપનીએ પરિપત્ર ને અને પરિપત્ર તથા સંબીત પરિપત્ર ને ઓક્ટેબર, ૨૦૨૩ના સંબીના આપીલ કર્યા પરિપત્ર તથા સંબીત પરિપત્ર ને ઓક્ટેબર, ૨૦૨૩ના સંબીના આપીલ કર્યાના પરિપત્ર તથા સંબીત પરિપત્ર ને ઓક્ટેબર, ૨૦૨૩ના સંબીના આપીલના પરિપત્ર તથા સંબીત કંપની કંપની કંપની કંપની કંપની કંપની સંબીત કર્યા ૧૯૩૧ના વાર્ષિક અને શેર દ્વારાન સરબાને કંપની નિચાર માર્ચ કર્યા સાથે કંપની કંપનીની વેબસાઇટ www.welspun.co.com અને બીએસઇ ત્રિમિટેડ, નેશલ સ્ટોક એક્સરોન્જ ઓફ હિસ્પીટ હિસ્પીટ તથા કલ્પના સ્ટેક એક્સરોન્જ ઓફ હિસ્પીટ સ્થા ક્લારના સ્ટેક એક્સરોન્જ હિસ્પીટ www.besindia.com. ઇન્ડિયા લિમિટેડ તથા કલકતા સ્ટોક એક્સચેન્જ લિમિટેડ www.bseindia.com

ઇન્ડિયા લિમિટેડ તથા કલકતા સ્ટોક એક્સમેન્જ લિમિટેડ www.bseindia.com, www.nseindia.com અને www.cse-india.com ઉપર તેમજ નેશનલ સિજ્યોટરી હિપોર્ડીઓરિટી લિમિટેડજww.evoting.nsdl.com હપર ઉપલબ્ધ છે. જે સભ્યોએ પોતાનું ઇમેઇલ સરતામું જે તે ડિપોઝીટરી પાર્ટિકિપન્ટ(સ) ખાતે નોંધાયેલ તર્શી હોય છતાં પ્રત્યક્ષ ન્યયુપે ચેર ધારાવતા કોય તેમછે કેપની નીજિટ્ટાર અને ચેર ટ્રાન્ટમર એજન્ટ, તિલક ઇમેડાઇમ ઇન્ડિયા પ્રાઇટિ લિમિટેડ mtheplotes(@inkirtime.co.in પાસે અપ્હેટ કરી લેવા બિનોતી છે. કંપનીએ એઝએમ દરમિયાના ઇન્ડિયા પ્રાઇટિયા લિમિટેડ mtheplotes(@inkirtime.co.in પાસે અપહેટ કરી લેવા બિનોતી છે. કંપનીએ એઝએમ દરમિયાના ઇન્ડિયા પ્રક્રિયા પારદર્શક રીતેયોજવા માટે સ્ટ્રિટિનાઇઝર તર્શક કુ. માનસી છાપ્ટિયા (FCS:7447 CP:8120) કે તેના વિકલ્પે શ્રી જિગર શાહ (FCS: 8918 CP: 13936) કે, જેએમરેએ એક એસોસિયેટસ એલએલપી, પ્રેક્ટીસિંગ કંપની સેક્ટરીનીની નિમાણક કરોત છે. કેપનીએની કરનોક પાર્ટીય અર્થે સ્ટ્રિટિનાઇઝર ત્યુપે સે સ્ટાર્યાએ એઝએમમાં કર્યાવેલી કાંચાલીમાં માટે અનેલ્સિડીએલ કારા ('રિમોટ ઇન્ વોર્ટિ') પ્રતિથી ઇલેક્ટ્રેનિક રાઢે મતદાન કરી રાકતે. સભ્યોને આથી 110 કરનોની કોમ્ડિયા આ એને કે, લે

- આથી ભાઇ કરવામાં આવે છે કે,
 (એ) એજીએમ નીટિસમાં દર્શાવેલ કાર્યવાલી માટે માત્ર રિમોટ ઈ-વોર્ટિંગ અને ઈ-વોર્ટિંગનાં માદ્યમથી જ તવદાન કરી શકાશે.
 (બી) રિમોટ ઈ-વોર્ટિંગ રવિવાર, રર સપ્ટેમ્બર, ૨૦૧૪ના (સવારે ૯.૦૦) કલાકે શરૂ શશે એને બુદવાર, ૨૫ એટેમ્બર, ૨૦૧૪ (સાર્જે ૫.૦૦) કલાકે બંદ શશે. (સી) રિમોટ ઈ-વોર્ટિંગ કે ઈ-વોર્ટિંગ ક્ષારા મતદાન કરવાની પાત્રતા માટે કટ-એક્ તારીખ ૧૨ સપ્ટેમ્બર, ૧૦૫૪ને ગુપ્રવાન કાર્ડિ કરવામાં આવેલ છે. ડેડો) રિમોટ ઈ-વોર્ટિંગ મોડકુલ બુધવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૪ના સાંજે ૫.૦૦ કલાકે બંદ શશે. ત્યાર બાદ રિમોટ ઈ-વોર્ટિંગ શર્ટિશાકો નહીં.
- સભ્યો એ જીએમ દરમિયાન વોર્ટિંગ સુવિધા દ્વારા એજી એમમાં વીસી/ઓએવીએમથી ઉપસ્થિત રહી શકશે. જો રિમોર ઈ-વોર્ટિંગ દ્વારા મતદાન (8)
- વાસા/ અઅવાઅમથી ઉપસ્થિત રહી શકશે. જો રિમોટ ઇ-વોર્ટિંગ બ્રાંસ મતદાન કરવાનું શક્ય ન થયું વેધિ તો ઇ-વોર્ટિંગ મારફત પણ મતદાન કરી શકાશે. એજીએમ શરૂ થયા પહેલા સિમોટ ઇ-વોર્ટિંગ કર્યું હેય તો તેઓ મેજીએમમાં ઉપસ્થિતરથી શકશે, પરંતુ કરીથી મતદાન કરી શકશે નહીં. કંપનીની કટ-ઓફ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ને યુટ્વારના રોજ પેઇડ અપ શેરમૂકીનાં પ્રમાણમાં શેર ધરાવતા હેય તેટલા પૂરતા મતદાન મેટે હક્કદાર રહેશે. (એ) (m)
- . (એચ) એજીએમ નોટિસ મોકલયા પછી અને કંપનીની કટ-ઓફ તારીખ ગુરુવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના શેર ધરાવતા હોય તેવા સભ્યો evoting@nsdl.co.in અથવા કપની /રજિસ્ટ્રર એન્ડ ટ્રાન્સફર એજન્ટને વિનંતી કરીને આઇડી પાસવર્ડ મેળવી શકાશે. જ્યારે સીકીએસએલ અને એન્એસડીએલ ખાતે અગાઉથી નોંધાચેલ સલ્ચો પોતાના પ્રવર્તમાન યુઝર પાસવર્ક દ્વારા રિમોટ ઈ-વોર્ટિંગ કરી શકશે જેની નોંધ લેવી.

વોટિંગ કરી શકશે જેની નીંધ વેવડી.
(આઇ) જે વ્યક્તિનું નામ સભ્યોનું રિજિસ્ટર કે બેનીફિશિયલ ઓનરમાં ડિપોડીટરી ખાતે કટ- એક તારીએ નીંધાયેલ કરો તેઓ જ એજીએમ દરમિયાન રિમોર ઇ-વોટિંગ કેઇ-વોટિંગ કરવા માટે હક્કદાર ગણાશે.
(જે) એજીએમ દરમિયાન સિમોર ઇ-વોટિંગ સંબંધિત કોઇપણ સુરકેલી જણાય તો કંપની સેકેટરી, ચેલ્કપન કાઉસ, કમલા મિલ્સ કંપાઉલ્કક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંલઇ-૧૦૦ ૧૩ અથવા CS WCL@westpur.com કે +૯૧ (૦૨૨) 9 913 9 ૪૩૦ની કામકાજના દિવસોએ સવારે ૧૦.૦૦થી સોજે ૪.૦૦ દરમિયાન સંપર્ધ સાથી શકે છે.

ઈલેક્ટ્રોનિક રાહે વોટિંગ સુવિધામાં કોઈપણ મુશ્કેલી <mark>હોય તો એનએ</mark>સડીએલ ફેલ્પડેસ્કને સંબોધીને evoting@nsdl.co.in અથવા ટોલ ફી નં. ૦૨૨-૪૮૮૬ ઝ૮૦૦નો સંપર્ક સાધી શકાયો. વેલસ્પન કોર્પ લિમિટેડ

મુંબઈ, સપ્ટેમ્બર ૪, ૨૦૨૪

सही/-मारस शाह આસિસ્ટન્ટ કંપની સેક્રેટરી ACS: 30357 43

અંજાર : પર્યુષણ પર્વ નિમિતે સરકાર દ્વારા કતલખાના બંધ રહે તેવી યના આપવામાં આવી છે. અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ગઈકાલે વીડી રોડ પાસેથી ટ્રકમાં ખીચોખીય લઈ જવાતા ૯ ભેંસ અને ૭ પાડીને ભચાવી લેવાયા હતા. આધારા પુરાવા ન મળી આવતા દિયોદરના મહંમદખાન જુસબખાન બ્લોચ અને જહુનામહંમદ અસલમ મહંમદરજી શેખની ધરપકડ કરાઈ હતી. આ અબોલ જીવોને કતલખાને લઈ જવાતા હોવાની શકયતા છે. હાલમાં અબોલજીવોને પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી અંજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અંજાર નગરપાલિકા અંશર-કચ્છ

ાવેરો ભરવા તેમજ નોંધણી કરાવવા બાબતે જાહેર નોટીસ

ગુજરાત રાજ્ય સરકારના આદેશ પુજબ તા.01/10/2006થી અંજાર નગરપાલિકા સ્તારમાં વ્યવસાય કરતા તબીબો, ધારાક્ષાસીઓ, ઈજનેરો, કમીશન એજન્ટો, જુદા જુદા ત્યુંક્ટરો, વ્યવસાય, વ્યાપાર, ધેપો અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૬ હંઠળના લસાયીઓ તેમજ સદરહું વ્યવસાયીઓના પચારદાદો અને તેનતાદારો વચ્ચાયીઓ પાસેથી લસાય વેરાના કરદાતાના તા.01/07/200/થી ઉપરાવધા અંગેની કલેક્ટીંગ એજન્ટ તરીકેની મગીરી નગરપાલિકાઓને સોપવામાં આવેલ છે. જેથી જે કરદાતાઓએ વ્યવસાય વેરા પિતામ હોળ સ્વર્જી આ દ્વાર્ય હવે હેમણે એમ્પ્ટર્સ આ પ્રધાન કર્યાલો સ્વર્શિક સ્વર્શિક સ્વર્શિક સ્વર્શિક સ્વર્શિક નધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમણે સેનઃ૨૦૨૪/૨<mark>૫ના વર્ષનો તા.૩</mark>૯

અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમણે સેનારભ્રંગ્રેટમાન વર્ષનો તા.30/oc/રભ્ય સુધી નગરપાલિકા કચેરીએ ઓફિસ સમય દરમ્યાન ગુભરૂ વ્યવસાય વેરો ભરી પહોંચ મેળવી લેવા જાણ કરવામાં આવે છે જેની નોંધ લેશો.

વિશેષમાં નગરપાલિકા વિસ્તારમાં વ્યવસાય કરતાં તબીબો, ધારાશાઓઓ, ઈજનેરો, દિમાન બેજન્ટો, જુદા જુદા કોન્ટ્રાક્ટરો, વ્યવસાય, વેપાર, પંધા અને રોજગાર વેરા અધિનિયમ હેઠળ વ્યવસાય વરાને પાત્ર થતાં કરદાતા તરીકે તેમજ પગારદારો અને વેતનદારોના કરદાતા નોંધલી (જીસ્ટ્રેશન) કરાવેલ ન હોય તેના કરદાતાઓ પાસેથી નિયમો અનુસાર દંડ અને વ્યાસ સાથે વ્યવસાય વેરો ભરેલ ન હોય તેવા કરદાતાઓ પાસેથી નિયમો અનુસાર દંડ અને વ્યાસ સાથે વ્યવસાય વેરો વસુલા કરવામાં આવશે. ઉપરાંત જે વ્યવસાયોઓએ આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી તાત્કાલિક નગરપાલિકા કચેરીમાં તા.30/oc/રભ્ય સુધી રજીસ્ટ્રેશન કરાવી કરદાતા કોડ નંબર મેળવી લેવા તેમજ વેરા ભરવાનું કરજીસતા હોઇ સુધી રજીસ્ટ્રેશન કરાવી કરદાતા કોડ નંબર મેળવી લેવા તેમજ વેરા ભરવાનું કરજીસતા હોઇ સુધી રજીસ્ટ્રેશન કરાવી કરદાતા કોડ નંબર મેળવી લેવા તેમજ વેરા ભરવાનું કર્યાલ ક્લાઈ સ્ટાર્શન કહિતા હોઇ નંબર મેળવી લેવા તેમજ વેરા ભરવાનું કર્યાલ કહાઈ સાથ્યો પાસેથી વ્યવસાય વેરા અને નિયમો અનામાર કાલ્ય કાલ્યેકાને ત્રાયા પાસેથી વ્યવસાય વેરા અને નિયમો અનામાર કાલ્યેકાન વ્યવસાયો પાસેથી વ્યવસાય વેરા અને નિયમો અનામાર કાલ્યો પાસેથી વ્યવસાય વેરા અને નિયમો અનામાર કાલ્યો હાલ્યેકાને

મુંદત વિત્યે કેસુરદાર કરદાતા વ્યવસાયી પાસેથી વ્યવસાય વેરા અને નિયમો અનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેની પણ નોંધ લેવી.

અને નાયબ વ્યવસાય વેરા કમિશ્ અંભર નગરપાલિકા

નં.૧૫૨૮ મ્યુનિસિયલ ઓફિસ, ગુમાસ્તા ધારા શાખા, અંજાર-કચ્છ તા.૦૩/૦૯/૨૪



પરમધામવાસી સ્વ. રણછોડબાઈ ઝુવાબાઈ ગોપાલભાઈ ભોજણી (આહિર

ઉં.વ. ૫૩) સ્વ. તા. ૦૩-૦૯-૨૦૨૪, શ્રાવણ વદ અમાસ ગામ : રતનાલ, તા. અંજાર

नैनं छिन्हन्ति शस्त्राधि नैनं हहति पावडः । न यैनं इलेहयन्त्यापो न शोषयति भाउतः ॥ નથી હયાત પણ સાથે કે એવું લાગ્યા કરે છે, હર પળે આપની

ઉપસ્થિતિનો અભાસ થયા કરે છે, ચાદમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે... મન હજુ માનતું નથી કે આપ અમારી વસ્ચે નથી.. પરમકૂપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપે એજ પ્રાર્થના... ૐ શાંતિ... ૐ શાંતિ... ૐ શાંતિ...

सह्गतनुं भेसएं तेमना निवास स्थान तणावशेरी, પાતાળેશ્વરમંદિરની બાજુમાં, ગામ : રતનાલ, તા. અંજાર (કરછ) મધ્યે રાખેલ છે.

ःः शोडभःन परिवारक्षनो ःः

भोटाजापा

भोटाजापा

पिता

515

लाई

लार्थ

ભાઇ

लार्थ

ભાઇ

लार्थ

ભાઇ

ભાર્ય

ભાર્ય

UNI

पुत्र

पुत्र

ભત્રીજા

ભત્રીજા

ભત્રીજા

બદેન-બનેવી

દિકરી-જમાઇ

રવ. ગોપાલભાઇ તેજાભાઇ ભોજાણી સ્વ. અરજણભાઇ ગોપાલભાઇ ભોજાણી જીવાભાઇ ગોપાલભાઇ ભોજાણી વાસણભાઈ મેપાલભાઈ મોજાણી (પૂર્વ રાજ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય) અરજણભાઇ 3પાભાઇ ભોજાણી અસ્લ્રણભાઈ ફિરાભાઈ લોજાણી સ્વ. અરજણભાઇ બીજલભાઇ ભોજાણી કાનાભાઇ અરજણભાઇ ભોજાણી

સ્વ, ત્રીકમભાઇ અરજણભાઇ ભોજાણી રણછોકભાઈ અરજણભાઈ ભોજાળી **35ાભાઇ અર**૧ણભાઇ ભોજાણી કાનજીભાઇ જીવાભાઇ ભોજાણી નંદલાલભાઇ જુવાભાઇ ભેજાણી

ત્રીકમભાઇ વાસણભાઇ ભોજાણી રણછો5ભાઈ વાસણભાઈ મોજાણી नवद्यथमाई वास्थमाई भोन्नणी સમીબેન વાદામાઈ હીરાભાઈ માતા જગદિશભાઇ રણછોડભાઇ ભોજાણી તલસીભાઇ રુપછોડભાઇ મોજાળી

પ્રકાશભાઇ રવછોડભાઇ ભોજાણી પૂજાબેન અમૃતભાઇ માતા કિશોરભાઇ નંદલાલભાઇ મોજાણી

बामेसमाई मंहबाबमाई मो<u>न्त्र</u>णी मधसहनवार्ध डान्ड्रकार्ध कोञ्चणी

સમસ્ત ભોજાણી પરિવારના જયશ્રી સધ્યિદાનંદ